

જો લોકપાલો બહુરાષ્ટ્રીય કંપનીઓના કે સાઉદીના કે મિશનરીના એજન્ટ બની જાય, તો શુ કરવુ?

નાગરીકોને વિનંતી - આપ સાંસદોને ‘સમજાવો’ કે અન્નાજીનો લોકપાલનો કાયદો, રાઇટ ટુ રિકોલ લોકપાલ ની કલમો સાથે, તત્કાલ પસાર કરે

જનલોકપાલ જરૂરી છે. પણ આપણા મંત્રીઓ કે ન્યાયમુર્તિઓની જેમ જો લોકપાલો ભ્રષ્ટ, બહુરાષ્ટ્રીય કંપનીઓના એજન્ટ કે મિશનરીઓના એજન્ટ બની જાય તો શુ પાંચ વર્ષ ટર્મ પતે ત્યાં સુધી રાહ જોવી? ના. નાગરીકો ભ્રષ્ટ લોકપાલને બદલી શકે, તેવી કલમો લોકપાલમાં મુકી તે કાયદો પસાર કરવો જરૂરી છે. આપને દાખલો આપુ - જો આપ ૧૦૦ લેબરની ફેક્ટરીનાં માલિક હોય, અને સરકાર કાયદો બનાવે કે એકપણ લેબરને આપ પાંચ વર્ષ સુધી નોકરીમાંથી કાઢી નહીં શકો; તો શુ ગેરશિસ્ત ઘટવાની? દેખીતુ છે કે ગેરશિસ્ત વધશે. બસ, ભારતમાં ભ્રષ્ટાચાર વધારે છે, તેનું આ એકમાત્ર કારણ છે. પશ્ચિમી દેશોમાં (દા.ત. અમેરીકામાં) નાગરીકો પાસે ન્યાયમુર્તિ, પોલિસ કમિશનર, નેતા વગેરેને બહુમતિથી તત્કાલ નોકરીમાં હાંકી કાઢવાની પ્રોસીજરો યાને ‘રાઇટ ટુ રિકોલ’ છે. જ્યારે ભારતમાં નાગરીકો પાસે ન્યાયમુર્તિઓ, પોલિસ કમિશનર, અધિકારી, નેતા વગેરેને નોકરીમાંથી દુર કરવાની પ્રોસીજર નથી. હવે જો લોકપાલનાં કાયદામાં નાગરીકો પાસે ‘રાઇટ ટુ રિકોલ લોકપાલ’ની કલમો નહીં હોય, તો લોકપાલો પણ હાલનાં નેતાઓ, ન્યાયમુર્તિઓ વગેરેની જેમ ભ્રષ્ટ કે બહુરાષ્ટ્રીય કંપનીઓના એજન્ટ કે મિશનરીઓના એજન્ટ બની શકે. આનાથી પરિસ્થિતી વધારે બગાડી શકે, કેમકે લોકપાલો પાસે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની, થર્ડ ડિગ્રી રિમાન્ડ પર લેવાની અને (જામીન ન મળે ત્યાં સુધી) જેલમાં પુરી દેવાની સત્તા છે. આમ જો લોકપાલો એમ.એન.સીના કે મિશનરીઓના એજન્ટ બની જાય, તો ભારતમાં એમ.એન.સી અને મિશનરીઓની પકડ વધુ મજબુત થશે. અન્નાજી અંધારામાં છે, અને અન્નાજી માને છે કે તેમના કાયદામાં રાઇટ ટુ રિકોલ લોકપાલ છે !! અન્નાજીનાં માણસોએ લોકપાલના ડ્રાફ્ટમાં હજારો કાર્યકરોની વિનંતીઓ છતા ‘રાઇટ ટુ રિકોલ લોકપાલ’ની કલમો ન મુકી !! કારણ? કારણ કદાચ એ હોય શકે કે ‘રાઇટ ટુ રિકોલ લોકપાલની’ કલમો ટીવી ચેનલોનાં એમ.એન.સી માલિકોને મંજૂર નથી. આથી મારી નાગરીકોને વિનંતી છે કે નાગરીકોએ સાંસદોને કહેવુંકે સાંસદો લોકપાલનો કાયદો પસાર કરે, તેમાં ‘રાઇટ ટુ રિકોલ લોકપાલ’ની કલમો મુકે જેથી જો લોકપાલો ભ્રષ્ટ થાય કે બહુરાષ્ટ્રીય કંપનીઓનો એજન્ટ બની જાયતો અમો નાગરીકો તેમને બહુમતિ દ્વારા બદલી શકે. કલમોનું લખાણ <http://rahulmehta.com/lokpai.pdf> પર છે. અનેક કુબુદ્ધિજીવીઓ કહે છે, આજે આપણે લોકપાલનો કાયદો ‘રાઇટ ટુ રિકોલ લોકપાલની’ વગર પસાર કરવો જોઈએ અને આવતા જનમમાં ‘રાઇટ ટુ રિકોલ લોકપાલ’ માટે લડત કરવી. આ કુબુદ્ધિજીવીઓનો બહિષ્કાર કરવો. ઉપરાંત રાજ્ય સ્તરે નાગરીકો ભ્રષ્ટ લોકઆયુક્ત બદલી શકે, તે માટે ‘રાઇટ ટુ રિકોલ લોકઆયુક્ત’નું જાહેરનામું લાવવા નાગરીકોએ મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવી. અને ગોહત્યા ઘટે તે માટે ‘રાઇટ ટુ રિકોલ પોલિસ કમિશનર’નું જાહેરનામું આપવું. આ પ્રસ્તાવિત જાહેરનામાઓનાં લખાણ <http://rahulmehta.com/009.pdf> પર આપ્યું છે. વધુ માહિતી માટે ‘રાઇટ ટુ રિકોલ’ ફેસબુક ગ્રુપ જોઈન કરવું યા YouTube પર MehtaRahulC ચેનલ જોવી - રાહુલ ચીમનભાઈ મહેતા, રાઇટ ટુ રિકોલ ગ્રુપ , MehtaRahulC@yahoo.com , ૯૮૨૫૧-૨૭૭૮૦

આ જાહેરખબર વાંચવી, ચોંટાડવી અને સહુને ઝેરોક્ષો આપવી